



At & Post: Dashrath, N.H. No 8, Dist Baroda-391 740 (Gujarat-India)
Admn. Office: 328-329, Third Floor, Paradise Complex, Sayajigunj, Baroda-390 005. (Gujarat-India)
Phone: +91-265-2362966, • Email: info@rekvinalaboratories.com • Web: www.rekvinalaboratories.com

Date: 14.02.2024

To, The Manager, BSE Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street Mumbai- 400001.

**Company Symbol: VINRKLB** 

Script Code: 526075

<u>Subject: Newspaper advertisement titled statement of standalone unaudited Financial Results</u> <u>for the Quarter and Nine Months ended on 31st December, 2023</u>

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47(3) read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith copies of Newspaper advertisement for the statement of Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2023, published on 14th February, 2024 in the following newspapers:

- "Financial Express" for English Language national daily wide circulation;
- "Financial Express" in Gujarati (Regional) language.

Further, this will also be hosted on the Company's website at www.rekvinalaboratories.com

This is for your information and records.

Thanking you,

Yours faithfully,


For and on behalf of Rekvina Laboratories Limited

AMIT

STATE OF THE STATE OF THE

Amit Mukesh Shah Director DIN: 01993211

**Encl: As above** 



આપક્ષી ઉમ્મીદ કા ખાતા

824	કરવામાં અલી છે.									
-	m-d	ખેલતી-હન્	हेकामा क्लीनसम	એન.મી.એ.	ગાંભરત નોદીના ગુજળ					
d.	-874	-41H	(शिक्षकृतन्य माधिक) जुं जन्म	ਰਜ਼ੜੀਅ	બારી સામની તારીખ					
٩	સુરત	4480040000	જ્યાબેન બી. ક્લારોડિયા (દેવાદાર/ગીરવેદાર) અને	03-04-2028	\$1.0000644.0c/-					
	-	000450	ભગવાનભાઇ એમ. ક્લટોટિયા (સફ-							
			દેવાદાર/ગીરવેદાર), કવસેટિયા આવિલ							

hasad લિગત : પ્લોટ/ક્ષકિસ ને. ૧૯ (ફોગફળ સંદાગે ૪૦૧ ચો. સર્ડ પ્લોટ ર સર્તે નં. ૨૦૧/૧ સત્રે ૧૦૨/૨ લે.કી, મોલે–નરોડા, તાલુકો–સસાસ્તા, ઉત્તરે સબ્દે પે

URA GIBIRI DI SIRAMOR AND CARANTA CAR

દેવદાર, સફ-દેવાદારનું નાગ શ્રીન એકાઉન્સ ને.	क्ष्मण १३(२) क्रेक्स मांग्यश न्हेरीसनी ट्यामिन साने स्थल	ીલે મિલકતની વિગત
રવી સંગાળાા પરમાર (અર-૧૯૧૨), સ્પ્રેલાબેન સંગાળાા પરમાર (અર્લ-અર-૧૯૧૨), સંગાળાા સંગાળાા પરમાર (અર્લ-અર-૧૯૧૨), સંગાળાા પરમાર (અર્લ-અર-૧૯૧૨)	व्य-व्य-१४ तेमकव्याक इ. ४६-व्य-१४/-	શાલગઢ રેવન્થુ સર્વે નં. પરચાર પૈકી, પ્લોટ નં. રુ. કિસી સર્વે નં. જક્રમ/રુ. ભાનગઢ, સોટીલા, સુરેન્દ્રનગર, ગુભરાત-કદ્મપછ. ક્ષેત્રફુલ લન્ન્સી.મી., ઉત્તર : પ્લોટ નં. ૧૮, દક્ષિણ : પ્લોટ નં. ૨૧, પૂર્વ : ૬-૦૦ ગીહરનો રોડ, પક્ષિણ : પ્લોટ નં. ૧૭
HL000000080459 ધનસજ છે. જ્ઞાર્થ (અરજદાર), પ્રીચા ધનસજ સર્મા (સહ–અરજદાર)	90-09-28 31, 3053-303/-	ભ્લોક નં. ૨૦૫, કરી નગર લેલોનો નં. ૧, યુરત દિશી, મોલે-ઉલના રેવન્ય સર્વે નં. ૨૦૯/૧ અને ૨૧૦, ટીપી નં. ૨, સોરીજનલ/કાઇનલ
HL000000094956	अनु आर्थेत्र सक्षिय वर्ड-ध्य-इत्र दुभत्र व्याप	પ્લોટ નં. ૧, બીરમારસી એટ સાંભે, ઉલળાં, સુરત, સુરત દિટી, ગુજરાત-કરજરાત, ક્ષેત્રફળ પદલ સે. હુટ, ઉત્તર : ભ્લોક નં. રાદ દ દિશ્લિક: ભ્લોક નં. રાષ્ટ્ર, પૂર્વ : ભંગો ગામી દિલ બ્લોક નં. ૧૬૪, પશ્ચિમ : ત્રેડ લિલ બ્લોક નં. રાષ્ટ્ર

### 

COVOS

SHIGHS \$154-640.

(CHI 102282207011PLC00228.

(CHI 102282.2011PLC00228.

(CHI 10228.2011PLC00228.

(CHI 10228.2011P

हेकाराजेनां नाम 🔍	રમ ૧૩(૨) હેઠળ માં દીશની તાલીન સને	ગર્સ ભેરે ભિક્તની ભિન્ન
અમરતભાઇ એવારામભાઇ રાવલ, પાર્વતીબેન અમરતભાઇ રાવલ	0C-00-08 38.365649.39/-	મિલકત નાં 3/39/૧, આકારથી અનુક્રમ નં. 33૫, મૃ. સરવા, ગ્રા
(A/c No.) LNPA100516-170039683 &	38. 999 UNA-	પંચાસત, તા. અને ક્ષુ. પાછશ, પીલ : ૩૮૪૨૬૫, ક્ષેત્રહળ ક૮,૧૫
LNPAT04318-190082274	05-04-5x	યો.મી.
માનાભાઈ ખાનાભાઈ વધાકર, રાહલકમાર	0C-04-4X	મિલકત ને. સ્કલ્, દવલી, તા. મોડાસા, જા. સાળરસંદા, ગુજરાત
માનાભાઇ પાહીલ,પ્રેલિલાએન માનાભાઇ વણકર	#. 889364.89/-	પીલ : કદ3૦૦૧. કોગકલા ૩૦.૪૨ સો.સ્ટ
(A/c No.) LNHMT00516-170045013	06-03-58	
(A) C110.7 E1411M1100010-170045013		
કમળાએન સુરેશભાઈ પારેખ, કલ્પેશભાઈ સુરેશભાઈ સીની	क्ष. व०क्टक्तर प्रत्/-	પ્લોટ નં. ૧૩ઓ, સાઇકુપા રેસીડેન્સી, ખાતા નં. ૧૦૫૧, ભ્લોક નં
(A/c No.) LNSUK02217-180050399 &	31. E39.p39/-	વક્કલ/વ/વજ/વક્સે, તરસાકી, મહુલા, સુરત. ક્ષેત્રફલ ૮૧.૪૭ સો.મે
LNUDN09421-220218451	06-04-58	
भुनिस्तः भोतीसास करी,	05-05-58	રૂચો માળ, એ ૪૦૭ એ વિલ્હીંગ, માદલ રેસીફેલ્સી, એ લિંગ,
Bಸಕು ಸ್ಥಗಿಣ <b>ಚ</b> ನಿ	\$1. \$1\\$6\$0/-	વિષ્ણુનગર, ટિલ્ફિટ ગક્ષેશ ટાઉનગ્રીય પાસે, પાકી, રાચીન, કનસા
(A/c No.) LNSUR02917-180052178	04-05-6X	સુરત, પીન : ૩૯૪૨૩૦. ક્ષેત્રફળ ૪૫.૬૩ સો.મી.
મનિષભાઇ હરામુખભાઇ તલસાણીયા, કૈલાસબેન	0C-04-4x	પીએમજા ઇકલ્સએસ ૧૫–સમન સંગાય, ટી.પી. સ્ક (ઉત્પાસ-
भविष्यकातं तत्त्रयायीमाः श्रुकीलहारः	31.300099/-	કરોડ), ક્લેટ ને, ઇકલ્સ્ટરોઝ-૧૫/ડી-૧૨૦૧, સરત મ્યુનિસિય
als husbans income	05-03-58	કોર્પેટિયાના પીના : ૩૯૫૦૦૨. સ્ટેગકળ ૩૨૫ સો.ક્ટ
(A/c No.) LNUDN02618-190093919		armery writer and design and miles
દરીયાદેવી વંપાસમ સજાસેક્ષિત, રાજપુરોક્ષિત	04-04-98	ફલેટ નં. ૧૦૭, નક્ષત્ર કોમ્પલેકા, તા. પલસાસા, જી. સુરત, પીન
રશનાદમાં વધારમ રાગ્યુસાલા, શગપુરાલા ચંદ્રાસમ, જમીનદાર : નરપત જલાસમ કુપાર	31. 6440401-	કલ્પડાયા. સેંગ્રહ સામાના કાર્યા કાર્યા કરાયા છે. વ્યાગ સ્થાપ કર્યા કરા કર્યા કરા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરા કરા કરા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરા કરા કર્યા કરા કર્યા કરા કરા કરા કર્યા કરા કરા કરા કર્યા કરા કરા કરા કરા કરા કરા કરા કરા કરા કર
	06-04-68	Sees to taxabot selvin dram.
(A/c No.) LNSRT00319 200111614		
જીતેન્દ્ર શીશદારભાઈ ભાદ્રા, પાર્વતીબેન	05-03-58	ઇડભ્લ્યુએસ-૧-એફપીલ્ડ, સી-કલ્સ, ૧૧મનગર મહાનગર
લીવાધરભાઇ ભાઢ્ય, મનોષ્કલીવાધરભાઇ ભાઢ્ય	3. 505ADE/-	પાલિકા, જ્જાનગર, ધીન : કદ્૧૦૦૧. ફોલફલ ૩૦ શો.મી.
(A/c No.) LNHJG02619-200116145 &	al. veaeca/-	
LNJAM14622-230282437	06-05-58	
રાવસાહેબ પાઠીલ, પ્રતિભા પાઠીલ	05-05-58	ફલેટ લં. જી/પ, ગાઉન્ડ ફલોર, શુભમ રેસીડેલ્સી, મોજે વિમ્બાયત
(A/c No.) LNSRT05919 200122625	₹1. 2064372/− 05,-02,-2%	સુરત,પીન : કલ્કરન૦. કોગફળ ૧૮૮૪ ચો.મી.
પટેલ જુગુદરાંત કાહુભાઈ, પ્રેઝિલાએન પટેલ,	05-05-58	મોને હરાપરા, તા. અરાદરવા, અમદાવાદ, પીન : ૩૮૦૦૧૬ ખાતે
પદાર કુચુલ્લાર કાંગુલાઇ, Mretoria પદાર, જામીનદાર : રાવેરાકમાર માદીશાશ ભારોટ	31.00EXES/-	કિલત ભ્લોટ ને ૫૦ ની ટી.મી.સ્લીમ ને ૧૨૧ ના સોલ.પી.ને લ્લ
તામાનદાક : કાતકાઉમાંક મકાશાય તાકાજ	91. 4150426/-	ઘરાવતી જ્વીન ઉપર દેવ સાવિધા-ર તરીકે જાણીતી સ્ક્રીમમાં જો
	31.000000/-	નં. એવ ના પગા માળે કહેટ નં. ૫૦૪ વરીકેની રેસીડેન્સીયલ
	ar attended—	દિલકતા. ક્ષેત્રફળ ૧૦૪.૫૨ શો.મી. અને મોજે હંસપુસ, તા.
	0E-02-28	અસારવા, અમદાવાદ, પીન : ટ૮૦૦૧૬ ખાતે રિવત બ્લોટ ને. ૫૦
	05-01-68	ટી.પી.સ્ક્રીય નં. ૧૨૧ ના એફ પી.નં. ૯૧ ધરાવતી જ્લીન ઉપર દે
(A/c No.) LNADB02120 210160109,		ગામિલ-૨ તરીતે જાણીતી રહીમમાં ભ્લોહ નં. એવ ના પણ માટે
LNADB10120-210171688 & LNADB02220-210160129		ફ્લેટ નં. ૫૦૧ તરીકેની રેસીડેન્સીયલ મિલકત. ક્ષેત્રફળ ૯૮.૬૬. લો.મી.
દર્શન નાયક, જ્લાલીએન શનશ્ચામભાઈ નાચક,	94-94-48 31. 1866(186)-	મિલકત ને. કાપ, સનપૂર ગામ પંચાયત, તા. ઇક્ટ, જી. સાબટકોલ
નાશક દાનકશભાદાં બાળુલાલ, રેજમાળેન દર્શનભાદી નાસક	4. sector)-	ધીન : ૩૮૩૦૦૧. ક્ષેત્રફળ ૩૦.૪૫ સો.મી.
	-,	
(A/c No.) LNHIM00520-210170277		
મસુરી ઉત્તમભાઈ રહોડ, ઉત્તમ જ્લાસુખભાઈ રહોડ,	oc-os-sx	સીટી સર્વે નં. ૩૦, ભ્લોક નં. ૧૪, વૃંદાવન એપાર્ટમેન્ટ, ૩૧૧ે માળ
ત્યમુખદસ : અન્દરાયમાં ક્રમ્મેવલાલ મધવામા	સ. ૧૯૬૩૧૧/- સ. ૫૬૭૮૫૦/-	ફ્લેટ નં. ૩૦૪, શીલભા લુંડ, વેલકમ સ્કુલ પાસે, ચૂનાગર, ગુજરાત
	#. 469540/-	उद्दरकार, क्षेत्रकृता ४५.८० जो.भी.
	1	
(A/c No.) LNJUN02221-220187101		
સમલેજ્ઞભાઈ છે. ભોઈ, શ્રફમીએન કે. ભોઈ	06-04-68	જુલો મક્કલ લં. ૧૩૫૦, લવો મક્કલ લં. ૧૮૮૩, લભાવ સુલીચા, જલપુરા પાવી, છા. છોટાઉદેપુર, રેલેલ્યુ સર્વે લં. ૧૧/૧/૫, પીન : ૩૯૧૧૬૫. ક્ષેત્રફળ ૫૫.૮૦ લો.ગી.
(A/c No.) LNBDL03721-220189145	\$1. <u>₹296-96</u> /-	ગલપુત્ર પાવા, છી. કારાકદપુર, રવાન્યુ સવ ન. ૧૧/૧/૫, પીન :
અસોરુ હોઠકીમાં, લેઠકીમાં સ્ટીપલાબેન્ન,	04-04-58	मितकत नी. पगप, जामतता, विभव्य खोक प्राप्ते, खोक्. श्रुवाधर खे
ભગાત કારકાના, સાદકાના નાતકાવળ, વામીનદાર : વાવસ સામેતભાઈ ખટાશા	-\c2F0CY.E	
	04-05-52	મુ. મોઢા વડલા, તા. અલાવાડ, છુ. જામનગર, ગુજરાત રાજ્ય-
(A/c No.) LNJAM16822-230239747		उद्देशहर, हीश्रकुण १२०० सेकुट
શુરેશભાઇ પ્યાયટ, ભૂમિકાગેન સુરેશભાઇ માસર	05-05-58	સામ પંચાયત મકાવ લં. ૮, મુ. પંચવાક, તા. શોદીના, જી.
(A/c No.) LNRKM08122-230267529	हा. हु४६५३६/− ०६-०४-६४	સુરેન્દ્રનગર, પીન : કદ્દકપશ્૦. ક્ષેત્રફળ કટલ્સો.મી.
ભાગામાં ભીખાબાર્થ સરવા, ગીતાએન સાલુબાર્થ	05-05-58	મુ. એફીસાલા, તાલુકા બોટાદ, ભુ. બોટાદ, પીન : ક્રદ્રપ્રસ્થવ ખાટે
સાંતુલાક ભાગભાક સવલ, ગાતાબન સાંતુલાક રાવલ, ર્સબ્યક્લાર સાંતુલાઇ રાવલ, જબીનદાર :	31, VR-000/-	યું. રાશભાલા, તાલુક્ત બાદાદ, જી. બાદાદ, પાન : કફકાવ અદ દિશત ૧૫ બાદા ૫૦ સો.ફેટ વિસ્તારનું વાંકાકામ કરાતેલ
	@.445080/-	રેશીકેન્સીલલ મહાન તરીકે ગામતલ મિલકત ઇન્ડેશ ને. ૧૫૮.
રાંજ્યભાઇ દેવણીભાઇ કેવડીમા	04-01-63	મહાન મિવકત નં. દદકની ગામતળ મિવકત, ક્ષેત્રફળ ૧૬૫૦
(A/c No.) LNBOT16322-230277582		बो.क्ट
મુકેશ કબોડમલ સર્મા, શ્રીમતી સમન સૌમ, સર્મા,	44-04-48	મતાન ને. એ/૧૧૩, અજ્ઞમાર્લ છે.એ.કાઉર્સીય સોસાયટી ક્રિમિટેડ, ર
મુક્ત કજાડમાં સમા, સામદા સુમળ ચામ. સમા, શ્રી ફબોડ્મલ ભાવમલ શર્મા, શ્રી વિનસ એમ. સર્મા	B. E455946/-	ને. ૪૬૩, ૪૮૨, ગાસમી મંદિર પાશે, વક્સર, મક્સપુર કુઆઈડીસી છે
આ ઇજાડ્યાન કાવળના સાંગા, તેમ દાવળના કાંગ. શોગા		ના કર્યુંક, ૪૮૨, ગાસમાં માદર લોકો, લંક્સર, મહત્યુંસ સુરવાલકાસો સ
	93-63-78	

### U GRO CAPITAL LIMITED

U GRO

દેવાદાર(સે)નું નામ	केन्द्राम (से)-तुं न्यम	हैनासर (चे	)નું નામ
૧. સેમ.કે. કેશન કુગ, ૨. સેમ.કે. કેશન કુળ	માંગરા નોદીસની તાઉલ	Rovilled	B., Je tecoos)-
मामचेर कीवीरेड, ३. महिला प्रसालकार	01 <del>-04-0103</del>	diame.	<b>(I. 2000000</b>
ખીવનાથી, ૪. દિવા મનિયામાર નિવનાથી	261	Alexandra are distin	01-02-00W
	\$1. 424334041 <del>/-</del>	ongel andre	43-43-44W
લોન એકાઉન્સ નંબર :	01 <del>1-04-1</del> 212	teritory man	१९ प्रोतीय वी =4 प्रीतीय
HCFAHMSEC00001013248	Zect.	<b>Serios</b>	js. Queens/

(शिकावील क्रमीता) प्रमुख (अधिकृत क्रमीतानी)

Đ.	호 국용인에 유미국 ( CH) 구조	hu mhau, RomelLeor ratoriau.co	ganist Becomit, o right of 1 octo- m		
<b>23</b> 4	૩૦ મુન, ૧૦૩૧ ના શેજ પુશ ધરાં મિલલિકના અભાગા અનમોલિકેક નામાં વિગત	Goalke-u eld		(mile (n. meric) under milel une-s fronthe-ex mile	
~			montpoor attitues	NAME OF THE PARTY	
┖	neumidge mee	-	-		
₹	अवानी चीन्नी न्दर्श (तीरी) (वेदा, जनवारहर क्रने क्षाव अध्यक्षण चीने पहेचा)	(e.Ad)	(0.86)	-	
F	क्रमेर् ज्यान्त्र कृत्य संत्रि(युद्ध)( स्थलाति स्थ्रिस्थता स्थलात्त्र कृत्यत्त्र)	(0.84)	(0.EC)	-	
T	नेवा पार्ट अक्टपने केलने नहीं(तीतो) ( स्टानाम् कनेश्राता स्थातामा वीनो पार्ट)	(e.lk/)	(o.84)	-	
۳	व्यापनी कृत संस्कृत स्थानन ( व्यापनी न्यूने(रोटोर) (वेरामनी) कर्ने सन्त्य लेकुत स्थान (वेरा मनि) समित)	(e.tc)	(0.44)	-	
<u> </u>	Miles de 198 (p. 1/-di pa (but)	301.9	304.8	304.0	
匝	सन्तरको (पुर्नपुर्वाकेत सन्तरको केत्रकर्ना) पाला कर्मन स्वीतिक स्वतीकार्ग वर्गका पुरूष		-		
٢	જેટ લીક કચ્ચીર (AGREs ૧૯૫૧—૧) (જાણુ અને ભંધ લગલાએ માટે) ૧. મુલા ૨. વહારેલી	-	•	-	
1	ા ૧. કેલી (વિસ્તિમ અને અન્ય ઉસલ્લોગર રીક્યમાર્ગન્ટસ) નિયમનો, ૧૯૧૫ ના નિયમન ક	ક કેકલ સ્ટોન્સ	તે <b>ક્ટલો-જો</b> માં કાવણ ક	રેલ વિજારીક અને નવ	

,400	Exists and the second s	t viðus, gyrse-e Leom glet el. : +er krisssom	e-ale-enfanit eccer's day	nov, ip. a.ravil)	
 	Res	Redhese with	n angles of refs	भागाना वर्गना स्थापन विकासिक कार्ने	
4.		MALANIS WORLD		MANAGE AND ASSESSED.	
٩	ALUE DE BÉNNANA	-	-		
9	आस्मानो को न्यो (तो हो १९७५, कराजहारू धानो स्थाना कराव्या स्थाने कुर्वे )	(a.300)	(1,111)	(1.40	
	केर पूर्व नाराज्यो योज्यो नाहो((तोरो) (काल्याम् अप्ने/अस्तव कार्यास्या सेन्द्रे पत्री)	(0.20)	(1.00)	(0.00	
	केत पनी नक्टाओं सोम्ब्रो लड़ो((सेडी)(क्टाप्टाइप क्रमे/क्टापा क्रमां प्रकार सीनो पड़ी)	(0.200)	(1.00)	(0.00	
4	मामानी हुत संस्कृत समान (१ कार ने पोल्ले नहीं)(तीती) (देव पत्री) कर्न कल्क संसूक्त समान (देव पत्री) सकीत)	(0.30)	(4.00)	(0.20	
ī	व्यक्ति स्ट पुरी (मूम्प)-नी पुर्वामेश्वर)	864.8	341.3	34(1	
•	અન્ય મહે (વૃને પુરાવસિત અન્ય તો કિન્દ્રમની ) પાછળા વર્ષના ઓક્ષિકેક સહવેલામાં દર્ભાવ્યા મુખ્ય	-			
4	વૈજ્ઞ કોઠ ક્લામાં (માર્ગિકેક સાધ્યું—દો) (પાનુ માને લેવા સમકારને માટે) ૧. કુલ: ૧. વાર્તિક				

मंत्री के ते कारण कर के दिया है किया है किया

## SBFC એસબીએફ્સી ફા**ચ**નાન્સ લીમીટેડ

(જુની એસાવીએફસી ફાયવાન્સ માત્રવેટ લીગેટેક) દી એલ્ડ બીસ્ક્રેસ, રંગમ સેમ્પોલ, ગામ ચલ્લા, એસેરી-ફ્લો સેંદ, એસેરી (પૂર્વ), મુંગ : યુનિટ નં.૧૦૩, પહેલો માળ, સી એ

Bassed-an/ass-ad	क्षेत्रकारे स्वर्धनकारे क्षेत्रकारे	લોન અને જારી અલ	Results with qual firmer
પ્લોટ ને. ૧૬૯, સ્થામનગર,	: 49-42-2023 th-olisi cultu	277000017120H(PR00932421) कोन्डनी स्थल : १८.६६६५५२(- व्यक्ती स्थल हा. ७२१४५७६(- (सुविशा स्थल	પ્લોટ નં. ઘફ્દ, ક્ષેત્રફળ દર.૦૮ લો.મી., "સ્થામ નગર", રેતન્યુ રાવેં નં. ૧૪૭, ફ્ષેત્રફળ એકટ દ્-૧૧ ગુંજારો, સ્થામ નગર, મુકલમ-ગામ-રેલાયર ફુંબારડી, તાલુકો-સંબાર, સંગ સ્કુક્ટફેલ કિલો- સંબાર, સ્યુષ્ટ્રફેલ ક્લો-સ્થક પાયેની બૉલકામ કહિદાનાં તામા ખાગ આને હિસ્સા.

🕒 ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક

આપની ઉચ્ચીદ લ ખાતા (શિદ્યુલ્ક કોર્મસીચલ બેંક)

તા અંદ્રીયા ક્યા ઉત્પાસ, જારી માત, બોર તો પર, રોક્સ-૧૮, દોધા પેલે રોક્સ નાદી, તારી, આ પોલીક foot ત્યા, રોક્સેક્ટ ૩૧ (એએ કે ૭), પેલ્કાફ્યુ, લાગે રાહ્યુ, પાસ સ્થાવસ્થિતિ મિલકતો માટે કળજા નોટીસ

આવી નોટીસ સ્વાપ્લામાં આવે છે કિસ્તુરીઓવામાં માત્ર અને કિસ્તુરાના એક કલાવનિયાલા એકોફ્યુ અને એન્ફ્રોલીના કેવાની મહિલાડેટીફો ઇન્ટરેટર કોસ્ટ્ર, તેનાર હેઠત અને સિક્તુરીકીફી ઇન્ટરેટર (એન્ફ્રોલીના ફોન્ટરેટ) ઇન્ટરેટર કોસ્ટ્ર, તેનાર હેઠત અને સિક્તુરીકીફી ઇન્ટરેટર (એન્ફ્રોલીના) ઇન્ટરેટર કોસ્ટ્ર, તેનાર એક તેનાર કેતાની લગ્ન પડ (૧૩) હેઠતા પ્રાત્યાની ક્લિમોના કેતાની નાર્ટીફનાથી દર્શન કેઠતાને એને દેવને કોસ્ટ્રોલીના કર્યા ને બાદની કર્યો કરતાને અને હોક્ય સ્વાનીના તાર્ટીનાથી દર કરના યુક્તના વધાના વૃત્તિ પદ્માં કરે દેવાદારોને આ નોટીસ માવનાની તારીનાથી દર કિલ્તાની અંદર રસ્તુ યુક્તના વધાના વૃત્તિ કરવાર સ્વાનીના વ્યવસ્થી કરવાની બિન્દુલના આ હોતાની અંદરને કિલ્તારે અને વૃત્તિ અને કરતાની અંદરને છે નીત્રી સહી કરવાર વ્યવસ્થી વિસ્તુરીના સિક્તાર કરતાને કિલ્તાર કરતાને એને કરી કરતાને કર્યા કરતાને ક્લામોના હારીમે હાલ લીધો હોત્તાના લાગેની હોત્તાના લાગેની ક્લેશની કરતાના કરતાને સામાર લાગે કરતાના હારી હોત્તાના લાગેની હોત્તાના લાગેની ક્લેશની કરતાના કરતાને ક્લામોના લાગે વ્યવસ્થાન સામાને ત્રના પાયાના વાર્ચન કરતાના કરતાની કાલોકો હોત્તાના લાગેની ક્લેશનીક લાગે વાર્ચન હાર કરતામાં આવે એન્સને વિસ્તુર તો હોત્તાના લાગેની કોતાના લાગેની કોતાના કરતાના કરતાના કરતાના કરતાના કરતાના સામે હાર કરતાના વાર્ચન કરતાના કરતાની કાલોકો હોતાના લાગેની કોતાના લાગેની કોતાના કરતાના કરતાને કાલોકો કરતાના વાર્ચન કરતાના કોતાના સામે કાલોકો હાતાના સામાન લાગે કાલાકો કરતાના સામાના કાલોકો કરતાની કાલાકો સામાના સામાના સામાનો કાલાકો કરતાના કાલોકો કરતાના સામાના સામાના કાલોકો કાલાકો કરતાના સામાના કોતાના કાલાકો કરતાના કાલાકો કરતાના સામાના સામાના કાલોકો કાલાકો કરતાની કાલાકો કરતાના કાલાકો કરતાના કાલાકો કાલાકો કરતાના કાલાકો કરતાના કાલાકો કરતાના કાલાકો કરતાના કાલાકો કરતાના કરતાના કાલાકો કરતાના કાલાકો કરતાના કાલાકો કરતાના કરતાની કાલાકો કરતાના કરતાના

en d	શામ્યાનું નામ	લોકાઉન્દરનું નામ	દેવાદાર/જારીનદાર (મિલકતના માલિક) નું નામ	માંગણ નોદીસની તારીખ	જન્મ નોડીસની તાલીલ	માંગણ લોકીસ મુખ્ય ભારી સ્કલની તારીમ
٩	સુરત	શ્રી પઠાટ શાસ્ત્રીબી મહેમુદળાન	શ્રી પ્રહાર ચારબીઓ મહેમુદખાન (દેતાદાર/ગીરવેદાર) અને શ્રીમતી પદાશ મહેમુદ (સલ–દેવાદાર અને ગીરવેદાર)	e4/e6/2023	43/05/5058	<b>₹. 99.64806.40</b> ∮−

### દિગ્જામ લીમીટેડ

DIGJAM

(E3914 દ્વરૂપ ૧૦૦૦ (ઉસદ 17120128191-005809) વસ્ત્રાં એક્સેલ મહેલા એક્સેલ એક, ૧૧૫૦૧૨-૩૧૧ ૦૦૬ (ગુજરાત) ક્લેશ્વર 10000@વાંકામાંગાં વેચાયાશ્વર મામ્યાલીપ્રામાંગાં કર ક્લેશ્વર ૧૦૩૨ વા સેપ્યુપ્ત વાર્તી કિમાર્થક્ત અને નવ માસિક કરિકોમ્પર, ૧૦૩૨ વા સેપ્યુપ્ત વાર્તી કિમાર્થક્ત અને નવ માસિક (૧૦૦૦ માર્ચ અને કોલ્સ સ્ટ્રિટ્સ)ના નિમોદનાનો સાર્ટ્

And	Resilter.		नव महित्य संदे	- cardy	
	31.12.2023	31.12.2022	31.12.2023	31.03.2022	
કામકાજમાંથી કુલ માવક	631	908	2,102	3,410	
લાવાનો ગોલ્લો નક્ષે(તોટો)( દેરા, અપવાદરૂપ અને/સારવા સસાધારકુ ચીલો પહેલા)	(182)	(164)	(964)	(830	
વેસ પૂર્વે ગાળાની ચોખ્બો નક્ષે/(તોટો) (અપલાફ્ય અનેખલના અસાયારણ થોજો પછી)	(182)	(554)	(964)	(1,220	
કેશ પછી ગાળાનો ચોજનો નહી/(હોટો) (લપનાદ્યુપ અને લાભના સરાધારણ ચીધો પછી)	(182)	(554)	(964)	(1,220	
વાવાની કુલ સંયુક્ત આવક (ત્રાચાની (તોટી) (વેશ જાર્થ) અને અન્ય સંયુક્ત આવક					
(વેસ પક્ષી)સહીત)	(173)	(546)	(939)	(1,187	
કહિનદી શેર મૂડી	2,000	2,000	2,000	2,000	
અન્ય <b>લ</b> ક્કિટરી પૂર્વપૂરવાદિત અનામતો સિવાયની			Ι.		
સેરક્રેક કચ્ચારી (સેરક્રિક ફર. ૧૦ની)					
(વાશુ અને લેધ ક્રમકાલો માટે) :- મુલ અને વટાકેલી	(0.91)	(2.77)	(4.82)	(6.10	
പ്പ് - ല ചിവി / ദ്രാല്യ ബാവിച്ചം	क अपने टिक्ट	ed no de	വാവിക	(Garana)	

નશિક ૧, સાધા (શિક્ટામ સંપળતાનથન લખા કરતાતાન સામ્યાનન ૧૦૧૫ નો નિયામન કરે હેલા સ્ટોલ એક્સનેન્ટોનો ફાયાલ કરેલ. ૧૧ ડિરો ત્રેજ પુત્ર વાલી સિમારિલ(નંલ મારિલ નાશાંકિલ પરિભાગોની નિયાન સાર ઉપર મુજબ છે. સિમારિક(નંલ મારિલ નાશાંકિલ પરિભાગોની બીરોસાઈ અને એનાએસણની લેબસાઇટી અનુક્રમે www.beeim

# agriwise એગોવાછા ઉન્સર્વ લીમીટે: (૧૯૦૦ દેશર પેડો દ્વાનન લીધીર તરીકે બાદી) સુધાં કોફેલ (૧૧-૬૦૧ સુધા, પ્રાપ્યામ મેમારે, લેન્સ્સરકાર કેવના છે) કો

કળજા નોઢીસ (પરિશિષ્ટ ૪) નિશમ ૮(૧))

An Order મોદી સે પ્રશ્નિવિધા છે કે નિયાર માં (જ) વ્યક્તિ સાર્ચિકા માટે કર્યા કર્યા

ા રહેલી. શેર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય અંગે એક્ટલી કલમ ૧૩ની પેટા ર વાદરવે પ્રત્યે દેવાદારોનું ધમાન દોરવામાં આવે છે.

જનવાદાઓ પતા દેવાદારોનું ધામત દોરવાની સાથે છે. દિશ્કુલ્લા ૧ (સિક્યોલિકી)નીએ ભિલ્લાનની વિભત) દેવિકેન્સીયત દાઉલ ની. ૫, બીન સેક્ટિય જન્મ અને દોગી, પ્રોક્ટેજ્ટન્સીયત દાઉલ ની. ૫, બીન સેક્ટિય જન્મ સ્ટિયેન અંગ પ્રેકિયે, એક રૂ. જિલ્લાઈ જાદી સ્ટિયોલિક મુશ્કાન-માર્ટી, કેન્યનુ સર્વને, અંગ પ્રેકિયે, એક રહ્યું, બિના-અને પત્રોની સ્થાન ભિલ્લાનો લાગ ભાગ અને બીન કર્યો પત્રોડ ની. ૩૧, દરિશા : ૩૦-નન સુક જાદેર રોક, પૂર્વ : સર્ધિય ની. ૧ થી. ૫, પહિલા : સર્ધિ

NESYL ECI-ES CINES

(suid inegia liquid dibla cidà repla)

(CHI 1.27100A.1988PL.COST70

(CHI 1.27100A.1988PL.COST70

(CHI 1.27100A.1988PL.COST70

(CHI 1.2710A.1988PL.COST70

(CHI 1.2710A.1988PL.COST

П	-		date and	tel yell	us (Brawn)
m	Red	- Oracle	<b>म्य मंदे</b>	र महिल्ला करें	વર્ષના અરે
٠				31/12/2023 (m-militar)	
1.	कारकाश्मीची कुल स्थायक (चोष्प्पी)	457.58	430.12	1695.34	1514.26
2	ગાવાનો મેપ્પો નફો/(તોટો) (લેટ, દળવાણા				
	कर्ने/अक्टर अससावा बीकोप्रेसा)	73.28	137.50	254.12	168.50
3.	वेद्यपूर्वे आजानो जोजनो नहीं (तोडो) (स्थानाहम				
	અને/અથવ અસમાસા લીજો પછી)	73.28	137.50	254.12	168.50
4.	देखध्यति अस्त्रान्ते खोल्प्ते न्यूने /(तोक्षे)(असमादक्				
	પ અને/અલના અસાઇક્સસ શીએ પછી)	53.43	101.75	187.25	139.37
5.	ગાળાની કુદ વ્યાપક આવક (ગાળાના નફર્ફતોસ)				
	(बेश पति) अने सन्य स्थापत सारकांतीहे (बेश पति)				
	36d)	53.43	101.70	187.25	139.37
6.	महिन्दरी केर भूडी	1755.47	1,668.67	1755.47	1,668.57
7.	અન્યાનો (પૂર્નપુટલોકિત અન્યાનો				
	શિવાસની પાછલા વર્ષના સસ્વૈગામાં કર્યાત્યા મુજબ)	- 2			
8.	बेल्टीक क्यांकी (प्रतिशीक ३०.१/- नी)				
	(ચાલુ અને બેધ લગલન્યમાટે)				
	ym i	0.30	0.061	0.107	0.08
	restell:	0.30	0.061	0.107	0.08

## **FINANCIAL EXPRESS**

# **SCANPOINT GEOMATICS LIMITED**

Regd Office: D-1002-1021, 10th Floor, Swati Clover, Shilaj Circle, S.P. Ring Road, Shilaj, Ahmedabad, Daskroi, Gujarat, India, 380059 | CIN: L22219GJ1992PLC017073 E-mail: cs@sgligis.com | Phone No: +079 - 46023912 | Web: www.sgligis.com **Extract of Standalone and Consolidated Unaudited Financial Results** 

for the quarter ended December 31, 2023 (Rs.ln Lakhs)								
S	tandalone		C	onsolidat	ed			
Life of the contract of the contract	THE R. P. LEWIS CO., LANSING.	Company of the property of the party of the			PROGRAMME TO COMPANY OF THE PARTY OF THE PAR			
347.27	392.90	361.43	347.27	392.90	361.43			
20.58	19.42	17.80	20.49	19.32	17.79			
20.58	19.42	17.80	20.49	19.32	17.79			
15.26	13.94	11.06	15.16	13.84	11.05			
15.26	13.94	11.06	15.16	13.84	11.05			
1386.14	1386.14	1386.14	1386.14	1386.14	1386.14			
		8						
0.02	0.02	0.02	0.02	0.02	0.02			
0.02	0.02	0.02	0.02	0.02	0.02			
	Single Si	Standalone   Quarter   Ended   31.12.2023   31.12.2022   (Unaudited)   347.27   392.90   20.58   19.42     15.26   13.94     15.26   13.94     1386.14   1386.14     0.02   0.02	Quarter Ended         Quarter Ended         Quarter Ended         Quarter Ended           31.12.2023 (Unaudited)         31.12.2022 (Unaudited)         30.09.2023 (Unaudited)           347.27 392.90 361.43         20.58 19.42 17.80           20.58 19.42 17.80         17.80           15.26 13.94 11.06         11.06           1386.14 1386.14 1386.14         1386.14           0.02 0.02 0.02         0.02	Quarter Ended         Standalone         Quarter Ended         Quarter Ended         Standalone         Material Ended         31.12.2023         30.09.2023         31.12.2023         (Unaudited)         (Unaudited)         (Unaudited)         (Unaudited)         (Unaudited)         20.49           20.58         19.42         17.80         20.49           15.26         13.94         11.06         15.16           15.26         13.94         11.06         15.16           1386.14         1386.14         1386.14         1386.14           0.02         0.02         0.02         0.02	Quarter Ended 31.12.2023 (Unaudited)         Quarter Ended 31.12.2022 (Unaudited)         Quarter Ended 31.12.2023 (Unaudited)         Quarter Ended 31.12.2023 (Unaudited)         Quarter Ended 31.12.2023 (Unaudited)         Quarter Ended 31.12.2023 (Unaudited)         31.12.2023 (Unaudit			

- 1. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at the Meeting held on February 12, 2024.
- 2. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly ended Standalone and Consolidated Financial Results are available on the Stock
- Exchange website www.bseindia.com and on company's website www.sgligis.com The above results for the quarter ended on December 31, 2023 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

For Scanpoint Geomatics Limited

Place: Ahmedabad Date : February 12, 2024

Kantilal Vrajlal Ladani Whole Time Director (DIN: 00016171)

## fincare Fincare Small Finance Bank Limited Registered Office: 301-306, 3rd Floor, Abhijeet-V, Opp. Mayor's Bungalow, Law Garden Road,

Mithakhali, Ahmedabad-380006. Ph: +91-79-40011000. CIN No.U67120GJ1995PLC025373 Head Office: #835/39, 5th Floor, Bren Mercury, Kaikondanahalli, Sarjapur Main Road, Bengaluru-560035, Karnataka. Phone: +91-80-42504444, www.fincarebank.com

## APPENDIX IV - [See rule 8 (1)] POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorized officer of the Fincare Small Finance Bank Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2000 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 has issued Demand Notices for calling upon the Borrowers, Mortgagers, Co-borrowers and Guarantors to repay the amount mentioned in the said demand notice amount within 60 days (Sixty days) from the date of the said demand notice.

The Borrowers, Mortgagers, Co-borrowers and Guarantors mentioned herein above having failed to repay the said demand notice amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Physical Possession of the property/properties described herein below in exercise of powers conferred on him under sub-section 4 of Section 13 of the said Act read with Rule 9 of the Security Interest (Enforcement) Rules 2002.

The Borrowers attention is invite to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

The Borrowers, Mortgagers, Co-borrower sand Guarantors mentioned herein above in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property/properties will be subject to the charge of the Fincare Small Finance Bank Ltd. for an amounts and further interest and other charges thereon till the date of recovery.

SI.		Possession	Total Outstanding				
No.		taken on	Amount				
	MR/MRS GOVINDBHAI AMBALAL RATHOD, MR/MRS. Kantaben	Possession	Rs. 2,16,830/-				
	Ambalal Rathod, Demand Notices dated 02-06-2021, loan account no.	taken on:	as on 25-05-2021 interest				
	18660000133342	11/02/24	and other charges thereon.				
	Description of the Immovable Property: All that piece and parcel of immovable property bearing no all. that piece and parcel of						

Site Residential property bearing Gram Panchayat Property No.830, Situated at Village Lingada, Ta. Umreth, Dist. Anand and bounded on: Measuring East to West: 40 and North to South: 16 total admeasuring area:640 Sq. Feet, and bounded on the, EAST BY: Road of Fadiyu, WEST BY: Farm of Ravjibhai Shanabhai, NORTH BY: House of Mohanbhai Dahyabhai, SOUTH BY: Open Land Of Vadi. Along with present and future construction therein.

MR/MRS ARVINDSINH RAJUJI ZALA, MR/MRS. Ashaben	Possession	Rs. 372635/-
Arvindsinh Zala. Demand Notices dated 28-02-2020, loan account	taken on:	as on 24-02-2020 interest
no. 18660000013678	11/02/24	and other charges thereon.

Description of the Immovable Property: All that piece and parcel of immovable property bearing Property No. 312, admeasuring 58.30 Sq. Mtrs, Gram Panchayat Sr. No. 312, Zalano Moto Vas, at Bhesana, Tal & Dist Mehsana, Registration sub District and District at Mehsana. Measuring East to West 14 (Sq. Ft.) and North to South: 45 (Sq. Ft.) totally measuring 58.30 Sq. Mtrs along with present and future construction therein.. And bounded on the, EAST BY: House of Zala Chanduji Babaji; WEST BY: Public Road; NORTH BY: House of Zala Anduji Keshaji; SOUTH BY: Public Road; Along with present and future

3.	MR/MRS SOLANKI RAMTUBHAI SHANABHAI, MR/MRS. Solanki	Possession	Rs. 2,01,742/-
	Madhuben Ramtubhai, Demand Notices dated 02-06-2021.	taken on:	as on 25-05-2021 interest
	Ioan account no. 18660000090301	10/02/24	and other charges thereon.

Description of the Immovable Property: All that piece and parcel of immovable property bearing residential Property Bearing Gram Panchayat Property No.477, Situated at Village vadelli, Ta-Borsad Dist-Anand and bouned by: Measuring East to west :60 and North to South: 20 Total Admeasuring area 1200 Sq.ft., and bounded on the, EAST BY: House of Ranchodbhai Bhikhabhai, WEST BY: Farm Of Bodana, NORTH BY: House of Natubhai Nanubhai, SOUTH BY: House of Natubhai Nanubhai. Along with present and future construction therein.

Date: 14-02-2024, Place: Gujarat

Sd/- Authorized Officer, For Fincare Small Finance Bank Ltd.

TGB BANQUETS AND HOTELS LIMITED CIN: L55100GJ1999PLC036830

THE GRAND BHAGWATI Regd. Office: ""The Grand Bhagwati"", Plot No. 380, S.G. Road, Bodakdev, Ahmedabad - 380054

E-mail: info@tgbhotels.com Website: www.tgbhotels.com Tel. 079-26841000

### EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2023

	(₹ in lakhs except EPS						xcept EPS)
Sr.	Particulars Particulars	C	uarter Ende	d	Nine Mo	nths Ended	Year Ended
No.	1	31.12.2023	30.09.2023	31.12.2022	31.12.2023	31.12.2022	31.03.2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operation (net)	1090.19	912.03	928.44	2793.97	2944.89	4,218.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	65.86	17.99	54.19	100.65	85.54	144.43
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary items#)	65.86	17.99	54.19	100.65	85.54	144.43
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	65.86	17.99	54.19	100.65	85.54	136.29
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax and other comprehensive)	65.86	17.99	54.19	100.65	85.54	138.21
6	Equity Share Capital (Face Value of Rs. 10 each)	2928.64	2928.64	2928.64	2928.64	2928.64	2928.64
7	Other Equity						-
8	Earnings Per Share (of Rs.10/- each) for continuing/discontinuing operation						
	1) Basic	0.22	0.06	0.19	0.34	0.29	0.47
ı	2) Diluted	0.22	0.06	0.19	0.34	0.29	0.47

# Notes:

- The statutory auditor of the company have conducted a limited review of the standalone financial results for the qurter and nine month ended December 31, 2023 persuant to regulation 33 of the SEBI (LODR) Regulation 2015, the financial results have been review by the Audit Committee and thereafter approved by the Board of Directors at their
- respective meeting held on February 13, 2024 2 These financial statements have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind AS 34. Interim Financial Reporting prescribed under section 133 of the Companies Act. 2013 read with the relevant rules issued thereafter ('Ind AS') and other accounting principles generally accepted in India, to the extent
- The company do not have reportable segments other then hotels as per the Indian Accounting Standards. The figures for the previous period have been regrouped, rearranged and reclassified wherever necessary to confirm
- the current years figures, and as per the Ind As schedule III to the Companies Act, 2013. 5 The figures of the current quarter are the balancing figures between unaudited figures upto December 31, 2023 and unaudited figures upto September 30, 2023.
- 6 The full format of the unaudited standalone Financial Results for the quarter and nine months ended December 31, 2023 are available on the Stock Exchange websites i.e. www.nseindia.com, www.bseindia.com and on the company's website www.tabhotels.com.

For, TGB Banquets and Hotels Limited

Narendra G. Somani **Chairman & Managing Director** Place: Ahmedabad (DIN: 00054229) **Date**: February 13, 2024

SBI STATE BANK OF INDIA SARB (05181) 1st Floor, Ratna Artemus 42, Sandar Pate Nagar, Nr. Girish Cold Drinks Cross Road, Nr. Samudra Annexe, Off C.G.Road, Ellisbridge, Ahmedabad CORRIGENDUM

This is with reference to the e-Auctio Sale Notice published in newspaper or 04.02.2024 for property mentioned at Sr. No. 4 for Borrower Mrs. Hemlata Prateck Kejriwal. The intending bidders of said immovable property are hereby informed that, except Original Sale Deed executed in favour of mortgagor, all other Original link title documents, Original Possession letter, Original Share Certificate and other documents pertaining to this property are misplaced and could not be found. The intending bidder/s is to take note that the Bank will hand over the title documents and other property documents which are in custody of Bank. The successful bidder shall not entitled to raise any clain whatsoever against Bank in this regard All other terms and conditions of Said e-Auction Sale Notice remain unchanged. Date: 14.02.2024 Sd/- Authorized Officer. State Bank of India Place: Ahmedabad

## POSSESSION NOTICE

Whereas, Muthoot Home Finance Ltd. And L & T Finance Ltdunder the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) ("said Act") and in exercise of powers conferred under Section 13 (12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 ("said Rules") issued demand notices (as detailed in table below)calling upon the respective borrower, the guarantors and the mortgagors to repay the amount under the respective LAN NOs details of which are mentioned in the table below

And whereas subsequently. Muthoot Home Finance Ltd. has vide Assignment Agreement dated31-03-2023 and L & T Finance Ltd. has vide Assignment Agreement dated 31-12-2019assigned all its rights, title, interest and benefits in respect of the debts due and payable by the respective borrower/guarantor(s)/mortgagor(s) arising out of the facilities advanced byMuthoot Home Finance Ltd. And L & T Finance Ltdto borrower/ guarantor(s) along with the underlying immovable Property to Asset Reconstruction Company (India) Limited acting in its capacity as Trustee (as detailed in table below) for the benefit of the holders of Security Receipts. Therefore, in view of the said assignment, Arcil now stands substituted in the place of Muthoot Home Finance Ltd. And L & T Finance and Arcil shall be entitled to institute/continue all and any proceedings against the respective borrower/ guarantor(s)/mortgagor(s) and to enforce the rights and benefits under the respective financial documents including the enforcement of guarantee and security interest executed and created by the respective borrower/guarantor(s)/mortgagor(s) for the respective financial facilities availed by them.

The respective borrower/quarantor(s)/mortgagor(s) having failed to repay the said amounts, notice is hereby given to the respective borrower/quarantor(s)/mortgagor(s) in particular and the public in general that the undersigned being the Authorized Officer of Aroil has taken possession of the underlying immovable Propertydescribed herein below in exercise of powers conferred on him/her under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the said Rules on "AS IS WHERE IS & WHATEVER THERE IS BASIS' on the date mentioned below.

Borrower Name and	LAN No./ Trust	Demand Notice	Possession
Guarantors	Name / Bank Name	Date and Amount	Date
Borrower: Mangilal Chimanji Bhatiand BhanumatiMonghilal Marwadi, Address at: Under Girdharnagar Bridge, Makhubhai Ni Chawl, Shahibaug, Ahmedabad, Gujarat - 380004 Also At: Flat No 105, First Floor, Building 24, Shubh Griha, Mauje Moti Bhoyan, Vadsar Kalol Road Ta Kalol, Dist Gandhinagar, Gujarat, Gandhi Nagar, 382721, India	/ Muthoot Housing Finance Company Limited / Trustee of Arcil -Retail Loan Portfolio-086-A-	Thousand Six Hundred Eighty One And Paise Thirty Two Only) as on	08-02-2024 Physical Possession

Description of Property : Property owned by MangilalChimanji Bhati and Bhanumati MonghilalMarwadi: All That Part And Parcel Of The Property Flat No 105, First Floor, Building 24, Shubh Griha, Mauje Moti Bhoyan, Vadsar Kalol Road Ta Kalol, Dist Gandhinagar, Gujarat, Gandhi Nagar, 382721, India

Mr. Jagdishkumar	Thousand Seven	10-02-2024
Ramjibhai Shah and	Hundred Seventeen	Physical
Mrs. Alpana Shah	and Paisa Thirty Nine	Possession

Description of Property: Property owned by Jagdish R Shah All that right, title and interest of property bearing Row-Housing No. 179 admeasuring about 70 Sq. Yard and construction thereon admeasuring 58.52 Sq. Meter in the scheme of New Shramjivinagar Co. Operative Housing Society Ltd., known as "Samratnagar" Vibhag-2" of the land bearing Survey No. 41, Final Plot No. 41 of T. P. Scheme No. 50 situated at Mouje: Bagefirdosh, Taluka: City, in the Registration District of Ahmedabad and Sub-District: Ahmedabad-7(Odhav), which is bounded as under: East: House No. 180, West: House No. 178, North: House No. 184, South: Society Road

The respective borrower/guarantor(s)/mortgagor(s) in particular and the public in general are hereby cautioned that Arcilis in the lawful possession of the respective immovable Property mentioned above and under Section 13(13) of the SARFAESI Act, 2002, the respective borrower/guarantor(s)/mortgagor(s) or any person whatsoever, shall after receipt of this notice not transfer by way of sale, lease or otherwise deal with/alienate the respective ilmmovable Property, without prior written consent of Arcil and any dealings with the respective ilmmovable Property will be subject to the charge of Arcil for the amount as mentioned above along with future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges etc.

The respective borrowers'/guarantors'/mortgagors' attention is invited to the provisions of the Sub-Section (8) of Section 13 of the said Act, in respect of time available to redeem the respective above mentioned Immovable Property.

Sd/- Authorised Officer Place: Ahmedabad Asset Reconstruction Company (India) Ltd. Date: 14.02.2024 Asset Reconstruction Company (India) Ltd..

CIN: U65999MH2002PLC134884, Website: www.arcil.co.in Registered Office: The Ruby, 10th Floor, 29 Senapati Bapat Marg, Dadar (West), Mumbai - 400 028, Tel: +91 2266581300,

Branch Address: 610, Sun Square, Near Hotel Regenta Central, Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380 006, Gujarat. Tel: - 079-40306301/05

REKVINA LABORATORIES LIMITED Regd. Office: 328 Paradise Complex sayajigunj Baroda Vadodara, Gujarat - 390005, India

Rekvina CIN: L24231GJ1988PLC011458, E-mail: rekvina@gmail.com ,Tel No.: +91-265-2362966, Website: www.rekvinalaboratories.com EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2023 Year to Date Corresponding : figures for current | Months ended in period ended the previous year **Particulars** 31.12.2023 31.12.2023 31.12.2022 (Unaudited (Unaudited) (Unaudited) Total Income from Operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) (0.47)(1.22)(0.70)3. Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) (1.22)(0.70)(0.47)(0.47)(1.22)(0.70) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items). Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after (0.47)(1.22)(0.70)tax) and Other Comprehensive Income (after tax)) Equity Share Capital (Face Value of Rs. 5/-) 301.4 301.4 301.4 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (of Rs. 5/- each) (for continuing and discontinued operations) 2. Diluted:

Notes: The above is an extract of the detailed format of quarter and Nine Months ended Un-Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and Nine Months ended Un-Audited Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.

The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. The financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS') prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules thereunder and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations

2015 (as amended) and SEBI circular dated 05th July, 2016. The above results have been reviewed and recommended to the Board of Directors by the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held on Monday, 12th February, 2024. These results have been subjected to limited review by statutory auditors who have

For and on behalf of Rekvina Laboratories Limited

Amit Mukesh Shah Director (DIN: 01993211)

REKVINA LABORATORIES LIMITED  Regd. Office: 328 Paradise Complex sayajigunj Baroda Vadodara, Gujarat – 390005, Ind  CIN: L24231GJ1988PLC011458, E-mail: rekvina@gmail.com ,Tel No.: +91-265-2362966,  Website: www.rekvinalaboratories.com					
	EXTRACT OF STAI	NDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR	THE QUARTER ENDED 30	TH JUNE, 2022	(Amount in L
SI.		Particulars	3 Months Ended	Year to Date figures for current period ended	Corresponding Months ended in previous year
lo.		NAME AND ADDRESS OF THE PARTY O	30.06.2022 (Upaudited)	30.06.2022 (Unaudited)	30.06.2021 (Upaudited)

SI.	Particulars	3 Months Ended	Year to Date figures for current period ended	Corresponding 3 Months ended in the previous year
No.		30.06.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.06.2021 (Unaudited)
1.	Total Income from Operations		word 5	Ŷ.
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	(0.28)	(0.28)	- 3
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary items)	(0.28)	(0.28)	9
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary items)	(0.28)	(0.28)	
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(0.28)	(0.28)	
6.	Equity Share Capital (Face Value of Rs. 5/-)	301.4	301.4	301.4
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	- 3	3	-
8.	Earnings Per Share (of Rs.5/- each) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:			

Date: 12.02,2024 Place: Gujarat

- The above is an extract of the detailed format of quarter and Nine Months ended Un-Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter ended 30th June, 2022, Un-Audited Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be
- disclosed by means of a footnote. The financial results have been prepared in accordance with Indian Accounting Standards ('Ind AS') prescribed under section 133 of the Companies Act 2013 read with relevant rules thereunder and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015
- (as amended) and SEBI circular dated 05th July, 2016. The above results have been reviewed and recommended to the Board of Directors by the Audit Committee and subsequently approved by the Board

of Directors at its meeting held on Monday, 12th February, 2024, These results have been subjected to limited review by statutory auditors who have expressed an unqualified opinion

For and on behalf of Rekvina Laboratories Limited

Date: 12.02.2024 Amit Mukesh Shah

VISHAL BEARINGS LIMITED DITHOL (CIN: L29130GJ1991PLC016005)

Regd. Office: Survey No. 22/1, Plot No.1, Shapar Main Road, Shapar (Veraval), Rajkot, Guiarat-360002, India Tel.: +91 2827-252273

Email: legal@vishalbearings.com Website: www.vishalbearings.com

# EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER ENDED DECEMBER 31, 2023

(Rs. In Lakh) Half Year Half Year **Particulars** Quarter Quarter Quarter Year No. Ended Ended Ended Ended Ended Ended 30/09/2023 (31/12/2022) (31/12/2023) (31/12/2022) (31/03/2023) 31/12/2023 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) Unaudited) (Audited) 1 Total income from operations 2311.33 3597.42 8012.31 9004.54 11555.83 2878.75 2 Net Profit before tax (PBT) 12.81 43.58 841.10 209.70 922.05 1088.22 3 Net Profit after tax (PAT) 578.37 7.11 31.75 151.64 637.60 801.49 4 Total other Comprehensive 20.37 (13.41)34.42 3.81 84.71 (4.15)Income, net of Income tax 5 Paid up Equity Share Capital 1079.10 1079.10 1079.10 1079.10 1079.10 1079.10 6 Reserves 2492.63 2101.66 2492.63 2101.66 2256.29 2451.10 7 Earning Per Share (Face Value Rs.10/- each) a) Basic (Rs.) 0.38 0.48 5.40 2.19 5.87 7.30

b) Diluted (Rs.)

1) The above Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 12" February 2024. The statutory auditors of the company have carried out limited review of the financial results for the quarter ended 31" December 2023 and the above Financial Results are also available on our website www.vishalbearings.com and stock exchange website www.bseindia.com

0.48

5.40

0.38

2) The Above Unaudited Financial Results have been prepared in accordance with the applicable Indian Accounting Standards as prescribed u/s. 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and other recognized accounting practices and policies to the extent applicable.

3) Segment reporting as per Ind AS-108 is not applicable as Company operates only in one segment i.e. Manufacturing and selling of Bearing Rollers and allied activities.

For, VISHAL BEARINGS LIMITED

2.19

5.87

DIN: 00247302

7.30

**DILIPKUMAR CHANGELA** MANAGING DIRECTOR

यको बैंक (भारत सरकार का उपक्रम)

Date: 13.02.2024, Place: Ahmedabad



UCO Bank, Recovery Department, Zonal Office, Near Sanyas Ashram, Ashram Road, Ahmedabad, Pin - 380009, Phone: 079-40176910/40176900, E mail: zo.ahmedabad@ucobank.co.in

# **SALE NOTICE E - AUCTION** 20.03.2024 BETWEEN 1:00 PM TO 4:00 PM

Whereas under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, the Authorized Officer has issued demand notice dated for the recovery of sum of outstanding dues from the Borrowers / Guarantors / Mortgagors (herein referred to as borrowers). Further, In exercise of powers contained in the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, the Authorized Officer has taken the possession of the under mentioned secured assets, which are held as securities in respect of Loan/credit facilities granted. Whereas sale of the secured asset/s is to be made through Public E-Auction for recovery of the secured debt due to UCO Bank amounting to outstanding dues, plus interest and expenses incurred by the bank thereon. The General Public is invited to bid either personally or by duly authorized agent. SCHEDULE OF THE SECURED ASSETS

Date: 12" February, 2024

Place: SHAPAR, RAJKOT

No.	Name of Borrower /Guarantors	Outstanding Amount	Description of the Properties	Reserve Price & EMD	Branch Head Name & Contact Number
1.	Laxmanbhai Khimjibhai Maheshwari and Poorbai Nasi Maheshwari (Gandhidham (0759))	Rs. 7,24,646.15 plus interest and Incidental Exp. Demand Notice Date : 10.07.2023 Possession Notice Date : 11.10.2023	Plot No. 120, R S No. 128, Pruthvi Nagar, Kidana, Gandhidham, Kutch, Gujarat - 370201.	Rs. 9,92,000/- Rs. 99,200/- Bid Increase Amount Rs. 10,000/-	Satyam Kishor Agrawal (M) : 7405245167
2.	Mamta Subhash Mundetia and Subhash Ram (Gandhidham (0759))	Rs. 6,42,847.40 plus interest and Incidental Exp. Demand Notice Date : 11.09.2023 Possession Notice Date : 16.11.2023	Plot No. 113-A, R S No. 248/1, paiki 4 & 254/2 paiki 1 Bageshree Nagar-3, Varsamedi, Anjar, Kutch - 370110.	Rs. 6,93,000/- Rs. 69,300/- Bid Increase Amount Rs. 10,000/-	Satyam Kishor Agrawal (M) : 7405245167
3.	Dewda Bhupendra Bhaversinh and Swati Bhupendra Dewda (Gandhidham (0759))	Rs. 13,26,190.05 plus interest and Incidental Exp. Demand Notice Date : 11.09.2023 Possession Notice Date : 19.12.2023	Plot No. 20, Survey No. 506/2, Ambaji Nagar-4, Varsamedi, Anjar, Kutch, Gujarat - 370110.	Rs. 12,58,000/- Rs. 1,25,800/- Bid Increase Amount Rs. 10,000/-	Satyam Kishor Agrawal (M) : 7405245167
4.	Gangaben Laljibhai Jat and Laljibhai Gabhabhai Jat (Gandhidham (0759))	Rs. 8,30,444.62 plus interest and Incidental Exp. Demand Notice Date : 07.10.2023 Possession Notice Date : 19.12.2023	Plot No. 54, R S No. 5/2, Bageshree Heights, Kidana-Tuna Road, Kidana, Gandhidham, Kutch, Gujarat - 370201.	Rs. 8,96,000/- Rs. 89,600/- Bid Increase Amount Rs. 10,000/-	Satyam Kishor Agrawal (M) : 7405245167
5.	Samar Panchu Maity and Sushmita Samar Maity (Memnagar (1954))	Rs. 7,93,433.58 plus interest and Incidental Exp. Demand Notice Date : 13.10.2023 Possession Notice Date : 20.12.2023	Flat No. A1/12, 2nd Floor, Maruti Residency, Survey No. 1078, F P No. 38, T P No. 86, Behind Madrasi Mandir, Vatva, Ahmedabad-382440, Gujarat, admeasuring 62.70 Sq Mtr.	Rs. 11,25,000/- Rs. 1,12,500/- Bid Increase Amount Rs. 10,000/-	Prikshit Gangta (M) : 9816193113

Date & Time of Inspection: 18.03.2024, Time: 1.00 PM to 4.00 PM & Date & Time of E-Auction: 20.03.2024, Time: 1.00 PM to 4.00 PM

- The sale shall be subject to the Terms & Conditions prescribed in the Security Interest (Enforcement) Rules 2002 and to the following further conditions:
- (1). The properties are being sold on " As is where is". As is what is", and "Whatever there is ". (2). The particulars of Secured Assets specified in the Schedule herein above have been stated to the best of the information of the Authorized Officer, but the Authorized Officer shall not be answerable for any error,
- misstatement or omission in this proclamation & The secured asset will not be sold below the reserve price. (3). The auction sale will be "online through e-auction portal https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp
- (4). The bidders are also advised to go through the portal https://ibapi.in or www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp. (5). For more details if any prospective bidders may contact Shri. Subhash Kumar (Authorised Officer) (M: 9879474477) & (7833047472).

financialexp.epapr.in



Ahmedabad

Authorised Officer, UCO Bank